https://archive.org/details/bk1054/page/n0/mode/1up

KJ 172

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

શ્રી [illegible] ની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે ૨૬ ડિસે સોમવાર ના રોજ [illegible] ખેડોઈ માં ભરાયેલ મીટીંગ:-

શ્રીમાન ભાઈ [illegible] ભાઈએ શ્રીમાન (પ્રેસીડન્ટ) રતનશીભાઈ ખીમજીને પ્રમુખ પદ સ્વીકારવાની દરખાસ્ત.

શ્રીમાન પ્રેમજીભાઈ રામજીભાઈ એ ટેકો.

શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈએ આભાર સાથે પ્રમુખ પદ સ્વીકાર્યું અને [illegible] સફળતા [illegible]. શાંતી જાળવી રાખવા માટે સૌને પ્રાર્થના.

શ્રીમાન સેક્રેટરી [illegible] ભાઈએ મહાત્મા [illegible] મહારાજ ને ફરમાન કરેલ તે ઉપરથી:-

[illegible] દાન અને [illegible] વિષે. [illegible] શું? [illegible] વિષે.

મહાત્મા સેવાદાસજી ને ફરમાન કરેલ તે ઉપરથી:-

દાન, ભક્તિ વિષે. મહારાજ યુધિષ્ઠિર નો દાખલો. શ્રીમાન પ્રમુખ રતનશીભાઈ ને શાંતિ સેવા માટે ધન્યવાદ. [illegible] નો દાખલો. [illegible]. (૧) [illegible] (૨) [illegible] (૩) [illegible].

મહાત્મા [illegible]દાસજી ને ફરમાન કરેલ ઉપરથી:-

[illegible] શુભ પ્રસંગે [illegible] દાન [illegible] વિષે. [illegible] મહાત્મા [illegible] ભજન.

realpatidar.com

શ્રીમાન [illegible] ને ફરમાન થતા ઉપરથી:-

દાનથી થતા ફાયદા. [illegible]

[illegible]

https://archive.org/details/bk1054/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 5, 8, 13, 15, 16.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1054/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 16:34:41 +05'30'
Real Patidar

KJ 172

realpatidar.com

શ્રી લક્ષ્મીનારાયણ (વિષ્ણુ નારાયણ) ની મૂર્તિ પ્રતીષ્ઠા માગશર સુદ ૬ ને સોમવાર ના રોજ ગામશ્રી ખેડોઈ માં ભરાયેલી સભા:-

10-Dec-1945
સંવત ૨૦૦૨ માગસર સુદ ૬ સોમવાર

શ્રીમાન ભાઈ રવજીભાઈ ભાઈ કાનજી ભાઈએ શ્રીમાન (પ્રેસીડન્ટ) રતનશીભાઈ ભીમજી ને પ્રમુખ પદુ સ્વિકારવા ની દરખાસ્ત.

શ્રીમાન મેઘજીભાઈ રામજીભાઈ એ ટેકો.

શ્રીમાન રતનશીભાઈ ભીમજીભાઈએ સભાની પ્રમુખ પદુ સ્વિકાર્યું અને કુર્શીને ભારે ગૌરવતા [illegible]. શાંતી જાળવી રાખવા ભારે સર્વેને પ્રાર્થના.

શ્રીમાન શેઠશ્રી ગંગુભાઈ ભાણજી ભાઈએ મહાત્મા પ્રભુરામ મહારાજ ને ફરમાન કરેલ તે ઉપરથી:-

[illegible] દાન અને અધ્યાત્મ વિષે. ભગવાન કોણ તેમજ શું? [illegible] ઉપર જ્ઞાન [illegible] વિષે.

મહાત્મા સેવાદાસજી ને ફરમાન કરેલ તે ઉપરથી:-

દાન, કીર્તિ વિષે. મહારાજ યુધિષ્ઠિરના દાખલો. શ્રીમાન પ્રમુખ રતનશીભાઈને શાંતિ સેવા માટે ધન્યવાદ. સત્કૃત્યના દાખલો. દાનના વિભાગ. (૧) રાજ સરકાર (૨) ચોર (૩) અગ્નિ.

મહાત્મા [illegible]દાસજી ને ફરમાન કરેલ ઉપરથી:-

આપણા ગુરુ સમર્થ બ્રહ્મા દેવથી દાન ગુરુ વિષે. [illegible] મહાત્મા [illegible] દાસની [illegible] [illegible].

realpatidar.com

શ્રીમાન ગંગારામ શુક્લ પ્રોફેસરને ફરમાન થતા ઉપરથી:-

દાનથી થતા ફાયદા. દેશ સંસ્થાઓમાં આપવાથી થતો ઘેર ઉપયોગ. ગુરુકુળ એટલે શું. ગુરુકુળથી થતો ફાયદો. [illegible] માં પૈસા લોકો [illegible] મહારાજની સાથે [illegible] ઉડાવવા વિષે. [illegible] [illegible] [illegible] ઘેર ફાયદો [illegible] માટે [illegible] [illegible] [illegible] વિષે.

realpatidar.com

મહોત્સવ શ્રી લક્ષ્મીનારાયણ ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત:-

દાન વિગેરે, જાહેર, ફાળા અને ચઢાવા વાળાઓને તેમના નામ ના દેવા વિગેરે ^ફાળા વિગેરે બોલવાના રૂપે. લખાણના પૈસાની વ્યવસ્થા અને હિસાબ રાખવા વિગેરે બાબતમાં મત નક્કી કરવા વિગેરે બાબત કરીને કાર્યવાહી નક્કી કરવા વિગેરે મહારાજશ્રી માલાના દાખલે રાખવા અમારી મદદ કરવા વિનંતી.

બોલવા વિગેરે મુજબ નક્કી કર્યું:-

૧. શ્રીમદ્ ભાગવતમાં પધારેલ ભાગવતાચાર્યને રૂ. ૩૨૦૧) શ્રીમાન પટેલ ... માટે ... માટે જાત શ્રી ... વાળા એ આપીને બોલાવ્યું.

૨. દેવાલય. ... પધારેલ ... રૂ. ૧૫૦૪) શ્રીમાન ... માટે ... માટે જાત શ્રી ... વાળાએ આપીને બોલાવ્યું.

૩. ભાગ્યવાન શ્રી લક્ષ્મીનારાયણ ને મંદિરમાં પધરાવવાના ચઢાવામાં રૂ. ૪૦૦૧) ~~આપીને~~ શ્રીમાન ... માટે ... " ... વાળાએ આપીને ભાગ્યવાન શ્રી લક્ષ્મીનારાયણ ને મંદિરમાં પધરાવ્યા.

૪. ... પધરાવવાના ચઢાવામાં રૂ. (૭૦૧) શ્રીમાન ... માટે ... શ્રી. ફોરડા વાળા એ આપીને મંદિરમાં પધરાવ્યા.

૫. ગણેશને મંદિરમાં પધરાવવાના ચઢાવામાં રૂ. ૭૨૫) શ્રીમાન ... માટે ... જાતશ્રી ફોરડા (...) વાળાએ આપીને પધરાવવાની કરાવી.

realpatidar.com

૬. શ્રી ... ને મંદિરમાં ... ચઢાવામાં રૂ. ૧૦૫૧) શ્રીમાન ... માટે ... જાત શ્રી ... વાળાએ આપીને મંદિરમાં પધરાવ્યા.

૭. ~~શ્રી ... ... ચઢાવામાં રૂ.~~
શ્રી ... ના ... પડદો ઉઘાડવાના ચઢાવામાં રૂ. (૨૫૦૧) શ્રીમાન ... માટે ... જાત શ્રી ... વાળાએ આપીને ઉઘાડ્યો.
શ્રી લક્ષ્મીજી ને ... ઉઘાડવાના ચઢાવામાં રૂ. ૨૦૦૧) શ્રીમાન ... માટે ... જાતશ્રી ... વાળાએ આપીને ઉઘાડ્યો.

KJ 173

૧૦) શ્રી ભગવાન (લક્ષ્મીનારાયણ)ને છત્ર ચડાવવાના (ગુજરાતમાં) કોરી ૨૦૦૧) શ્રીમાન વાલજીભાઈ [illegible] ગામ શ્રી [illegible] વાળાએ લઈને ચડાવ્યું.

૧૧) શ્રી નારાયણ ભગવાનનો મુકુટ ચડાવવાના ચડાવામાં કોરી ૧૦૫૧) શ્રીમાન રામજીભાઈ રતનભાઈ ગામ શ્રી ખેડોઈ વાળાએ લઈને પહેરાવ્યો.

૧૨) શ્રી લક્ષ્મીજીને મુકુટ ચડાવવાના ચડાવામાં કોરી ૧૨૦૧) શ્રીમાન કુંવરજીભાઈ વિશ્રામ ભાણજી ગામ શ્રી ખેડોઈ વાળાએ લઈને ચડાવ્યો.

૧૩) શ્રી લક્ષ્મીજીને ડોકનો હાર સોનાના ઘરેણાના ચડાવામાં કોરી ૧૫૦૧) શ્રીમાન વાલજીભાઈ [illegible] ગામ શ્રી ખેડોઈ વાળાએ લઈને પહેરાવ્યો.

૧૪) શ્રી લક્ષ્મીનારાયણની પહેલી આરતીના ચડાવામાં કોરી ૧૦૦૧) શ્રીમાન હીરજીભાઈ [illegible] ગામ શ્રી ખેડોઈ વાળાએ લઈને ઉતારી.

૧૫) શ્રી લક્ષ્મીનારાયણની બીજી આરતીના ચડાવામાં કોરી ૭૦૧) શ્રીમાન કુરજીભાઈ પ્રેમા ગામ શ્રી કોટડા (ખેડોઈ) વાળાએ લઈને ઉતારી.

૧૬) શ્રી લક્ષ્મીનારાયણની ત્રીજી આરતીના ચડાવામાં કોરી ૭૦૧) શ્રીમાન દેવરાજભાઈ વાલજી ગામ શ્રી ખેડોઈ વાળાએ લઈને ઉતારી.

૧૭) શ્રી લક્ષ્મીનારાયણની ચામર ઢાળવાના ચડાવામાં કોરી ૭૦૧) શ્રીમાન કુરજીભાઈ શિવજી ગામ શ્રી કોટડા વાળાએ લઈને ચામર ઢાળી.

૧૮) શ્રી લક્ષ્મીનારાયણની છડી પોકારવાના ચડાવામાં કોરી ૬૦૧) શ્રીમાન ગોવિંદભાઈ [illegible] ગામ શ્રી કોટડા વાળાએ લઈને પોકારી.

૧૯) શ્રી લક્ષ્મીનારાયણનો ઘંટ વગાડવાના ચડાવામાં કોરી ૬૦૧) શ્રીમાન [illegible] ભાઈ [illegible] ગામ શ્રી [illegible] વાળાએ લઈને વગાડ્યો.

realpatidar.com

realpatidar.com

૨૦) શ્રી લક્ષ્મીનારાયણના દેવળે ઓટલા ફરસબંધીના ખર્ચામાં ફાળો (૨૦૦૧) શ્રીમાન [મિસ્ત્રી] કેશવજીભાઈ ગંગાધર [રાણ] ગામથી કુંભારીઆ વાળાએ આપીને ઉપકાર કરાવ્યો.

૨૧) શ્રી લક્ષ્મીનારાયણના દેવળે પાણીની ઓરડીના ખર્ચામાં ફાળો (૨૫૧) શ્રીમાન કાનજી ભાઈ દેવશી ગામથી રામપર(મોટા) (ગુજરાત) વાળાએ આપીને જશ માગ્યું કરાવ્યું:

૨૨) શ્રી લક્ષ્મીનારાયણને ઝુમ્મર ના ખર્ચામાં ફાળો (૧૫૧) શ્રીમાન કરસન ભાઈ કરમશી ગામથી કોટડા(અંજાર) વાળાએ આપીને ઝુમ્મર કરાવ્યો.

— × — × — × —

realpatidar.com

https://archive.org/details/bk1054/page/n6/mode/1up

-Khedoi Laxminarayan Temple Inauguration -Draft Minutes (1054)

KJ - 174

॥ ૐ ॥

realpatidar.com

મુ. ખેડોઈ તારીક ૮ - ૧૨ - ૪૫

સં. ૨૦૦૨ના માગશર સુદ ૪ ને રવિવાર નો. કાર્ય. કર્તા

કાર્ય કર્તા

જનરલ. ૧ પટેલ અરજણ.ન. કાનજી · ખેડોઈ
સ્વાગત-૧ ૨ " રતનશી ખેરાજ "
જનરલ. ૩ " ખેરાજ ભાઈ રાજા "
[illegible] ૪ " પચાણ ભાઈ વાલજી "
સ્વાગત [illegible] ૫ " કરશન ભાઈ રતનશી "
જનરલ. ૬ " નથુ ભાઈ રતનશી "
જનરલ. ૭ " રામજી ભાઈ નાયબ ફો. ~~[illegible]~~ ગુરુકુલવાળા
સ્વાગત - ૨ ૮ " રતનશી ભાઈ શામજી " "
૯ " શિવજી ભાઈ કરશન " "
[illegible] ૧૦ " કુરજી ભાઈ ~~[illegible]~~ હરજી ફો. [illegible]
" " ૧૧ " લાલજી ભાઈ · રતનશી " "
૧૨ " આલજી ભાઈ (રામજી) " "
૧૩ " કરશન ભાઈ · રતનશી " "
[illegible] ૧૪ " રતનશી ભાઈ. પુના - ખેડોઈ
[illegible] ૧૫ " (લખમ) ભાઈ ગોપાલજી " "
૧૬ " લખમ ભાઈ (નથુ) " "
જનરલ. ૧૭ " વાલજી ભાઈ પ્રેમજી - ધમડકા
૧૮ " રતનશી ભાઈ લખમ "
૧૯ " હીરજી ભાઈ. લખમ "
૨૦ " ~~[illegible] ભાઈ [illegible]~~ હરજી ભાઈ વાલજી [illegible]
સ્વયંસેવક ૨૧ " [illegible] ભાઈ · ~~[illegible]~~ ગાગોદર ~~[illegible]~~
સ્વયંસેવક ૨૨ " વાલજી ભાઈ (આલજી) "
૨૩ " [illegible] ભાઈ તેજા
૨૪ " પ્રેમજી ભાઈ કાનજી
૨૫ - ભાઈ રતનશી [illegible]
૨૬ - " [illegible]
સ્વયંસેવક ૨૭ - [illegible] [illegible]
" " ૨૮ [illegible] [illegible] · [illegible]

વોલન્ટીયર

૧ પટેલ. ગોપાલજી · ગાગોદર — કુંદરોડી
૨ " માવજી ભાઈ દેવજી - "
૩ " રતનશી · વાલજી - "
૪ " હરીરામ · [illegible] - "

૧ " નારાયણ ભાઈ દેવશી વોલન્ટીયર
૨ " લખમ ભાઈ · નથુ "
૩ " [illegible] ભાઈ · [illegible] "
૪ " જીવા ભાઈ · ગાગોદર "
૫ " ગોપાલજી ભાઈ · વાલજી "
૬ " રામજી ભાઈ [illegible] "
૭ " ગોપાલજી ભાઈ [illegible] "
૮ " વાલજી ભાઈ [illegible] "
૯ "

૧ પટેલ. રતનશી. ગોપાલજી "
૨ " રવજી લાલજી "
૩ " વાલજી હીરજી "
૪ " પ્રેમજી અરજણ. "
૫ " ખેરાજ કરશન "
૬ " કાનજી હરજી "
૭ " દેવશી રામજી "
૮ " રતનશી ગોપાલજી "
૯ " પ્રેમજી રતનશી "
૧૦ " રામજી પુના "
૧૧ " વાલજી પુના "
૧૨ " લખમ નથુ "
૧૩ " પચાણ [illegible] "
૧૪ " જીવા ગાગોદર "
૧૫ " ગોપાલજી વાલજી "
૧૬ " " [illegible] "

૨

પાણીનાખનાર

realpatidar.com

૧૭ પા. લાલજી ધનજી
૧૮ " દેવશી. નાનજી
૧૯ " નારાણ. દેવશી
૨૦ " ~~.~~ કુરશી રતનજી
૨૧ " શામજી. વિશરામ
૨૨ " શામજી લધા
૨૩ " રામજી વાલજી
૨૪ " વાલજી. લધા
~~૨૫ " હીરજી માવજી~~
૨૬ " હીરજી રતનશી
~~૨૭ " ભીમા. રતનશી~~
૨૮ " કેશરાભાઈ રતનજી
૨૯ " લાલજી માવજી
૩૦ " ~~રામજી~~ ~~હીરજી~~
૩૧ " નાનજી દેવજી
૩૨ " હરદાસ હીરજી
~~૩૩ " ... પ્રેમજી~~
૩૪ " કેશરાભાઈ. કરસન
૩૫ " લાલજી. શામજી
૩૬ " ~~...~~ હીરજી ~~પ્રેમજી~~ ખીમજી
૩૭ " માધવજી ~~...~~ ખીમજી
૩૮ " જાદવજી કુરશી
~~૩૯ " પ્રેમજી રતનશી~~
~~" દેવશી. લાલજી~~
~~" માવજી. રામજી~~
~~" ... ...~~
૪૩ " ધનજી રતનશી
૪૪ " છગનભાઈ. પ્રેમજી

કાર્ય કર્તા

રવિશંકરભાઈ દેવશીભાઈ. ૫
" નારાણ પ્રેમજી. ૬
" રામજી. દેવજી ૭
" રામજી વાલજી. ૮
" ભીમા. રતનશીભાઈ ૯
" જુમજી. ખીમજી ૧૦
" પ્રેમજી રતનશીભાઈ ૧૧
" હીરજી. માવજી ૧૨
" ગોપાલજી. રતનશી ઘોઘારી ૧૩
" જાદવજી કુરશી ૧૪
" ગોપાલજી. દેવજી ૧૫
~~" લાલજી રતનજી~~ ૧૬
" ગોપાલજી કાનજી ૧૭
" કુરજી. રાજી ૧૮
" હીરજી ખીમજી ૧૯
" માધા. ખીમજી ૨૦
" રતનજી. ખીમજી ૨૧
" માવજી રામજી ૨૨
" શામજી રામજી ૨૩
" ખીમજી નાનજી ૨૪
૨૫
૨૬
૨૭

realpatidar.com

૨૮
૨૯
૩૦

~~ઉકાભાઈ ... રતનજી ... ભીમા~~ ૨
" ખીમજી ભાઈ કુરશી - ૩
" કાનજીભાઈ દેવશી - ૪
" હીરજી ભાઈ કેડા - ૫

https://archive.org/details/bk1054/page/n8/mode/1up

KJ 175

3

ઉદ્ઘાટન - ૨૦૫૭ [illegible]
" [illegible] ૨૦૫૭
" [illegible]

realpatidar.com

realpatidar.com

KJ-176

॥ ૐ ॥

ખેડોઈ તા. ૯-૧૨-૪૫

realpatidar.com

સં. ૨૦૦૨ના માગશર શુદ ૫ ને રવિવાર નો કાર્યક્રમ

સવારના ૯ વાગ્યા ની મુદતે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન ના પ્રતિષ્ઠાના

તૈયારી કરવામાં આવેલ ને પ્રતિષ્ઠાના મુહૂર્ત ભગવાનને ગાદીએ બેસાડવાના

બાબત ગોઠવવામાં આવેલ ને તેના શાસ્ત્રોક્ત વિધિ ... ના હાથ થી

... હતું ને તેના પાછળ ... ના ... સાથે ગાડીઓ શણગારેલ

~~ગોઠવવામાં આવેલ~~ પાછળ ... ગોઠવવામાં આવેલ હતી ને તેની
... ... હતું ને તેના

પાછળ રથ ... ને તે પાછળ ... બેસવા માટે ...

રહી હતી ને તેના પાછળ ... હતા ને તેના પાછળ

શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન ના પાલખીમાં શ્રી ભગવાન ... લક્ષ્મીજી

... હતા ને ~~...~~ ... પાછળ ... શ્રી ભગવાનને

... હતા ને તે ... શ્રી ~~...~~ લક્ષ્મીજી

... હતી ને તે ... શ્રી ...

નારાયણ ના મંદિર ... ને ...

... હતું ને ત્યાર બાદ શ્રી ... ભગવાનના મંદિર

... હતું ને ત્યાર શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને ... શ્રી ...

... હતું ને ત્યાર શ્રી ભગવાનને મૂર્તિઓ ને

ભગવાનના મંદિરમાં પધરાવવામાં આવેલ ને ત્યાર ... ત્યારબાદ ...

... ... વાગ્યા ... ને ત્યારબાદ ...

પૂરું હતું ને ... .3 ... ...

realpatidar.com

realpatidar.com

શ્રીમાન પ્રેસીડેન્ટ રતનજીભાઈએ કૃતજ્ઞતા [illegible]

[illegible]

સેક્રેટરી [illegible] ટેલીગ્રામો

[illegible]

શ્રીમાન [illegible] કૃતજ્ઞતા [illegible]

[illegible]

શ્રીમાન પ્રેસીડેન્ટ રતનજીભાઈએ [illegible]

realpatidar.com

https://archive.org/details/bk1054/page/n11/mode/1up

KJ -177

realpatidar.com

ફેપરન

૧ શીવગણ ભાઈ લાલજી હીરાણી પાલા (નતરડા)

૨ માવજી ભાઈ દેવજી ફોરડા. (ગુજરજવાલા)

૩ ગોવિંદભાઈ ગંગદાસ ખેડોઈ

૪ હંસરાજ ભાઈ વશરામ માનકુવા

~~મંડપ વગેરેની ચેરમેન~~

૧ સ્વાગતના ચેરમેન

હંસરાજ ભાઈ વશરામ માનકુવાવાળા

તેમાં વોલન્ટેર

૧ રતનશી ગોવિંદ

૨ રવજી લાધા ભાણજી

૩ પ્રેમજી સરરણગ.

૪ મેઘજી કરશન

૫ કાનજી હરજી

૬ દેવજી શામજી

૭ માધવદાસ ગોવિંદ

૮ હીરજી મનજી

૯ હંસરાજ હરજી

૧૦ છગનલાલ પંચાણ.

---

૨ ઉતારા સંભાળીના ફેપરન

ખેરડાના માવજી ભાઈ દાનજી

૧ વાલજી હીરજી

૨ પ્રેમજી સામજી

૩ રામજી પુંજા

૪ વાલજી પુંજા

૫ નરસી ગંગાદાસ

૬ દેવશી મનજી

૭ નારાણ દેવશી

૮ સામજી પિતાંબર.

૯ [illegible]

૧૦ ~~[illegible]~~

૧૧ ગોવિંદ કેશવદાસ

https://archive.org/details/bk1054/page/n12/mode/1up
-Khedoi Laxminarayan Temple Inauguration -Draft Minutes (1054)

KJ 178

શ્રી જનરલ કમીટી

૧ અરજણભાઈ કાનજી
૨ દેવજીભાઈ પ્રેમજી
૩ રામજીભાઈ નાથા
૪ મનજીભાઈ શીવજી
૫ મેઘજીભાઈ રામા

યજ્ઞ કાર્ય

૧ પંચાણભાઈ લાલજી
૨ ~~શીવજીભાઈ દેવશી~~ દેવજી ભોજા
૩ કરશનભાઈ શીવજી
૪ સોમજીભાઈ લાલજી
૫ વિશ્રામભાઈ રામા
૬ ખીમજીભાઈ મનજી

સ્વાગત સમીતી

૧ શીવજીભાઈ દેવજી
૨ શીવજીભાઈ રામજી
૩ શીવજીભાઈ દેવશી
૪ કેશરાભાઈ પંચાણ (ઝાપડા)

ઉતારા સમિતિ

૧ શીવજીભાઈ પુંજા
૨ ખીમજીભાઈ ગોવિંદ
૩ ખીમજીભાઈ કરશન.
૪ કાનજીભાઈ દેવશી.
૫ હીરજીભાઈ જેઠા

realpatidar.com

https://archive.org/details/bk1054/page/n13/mode/1up

KJ 179

realpatidar.com

રસોડા સમિતિ

૧ કરમશી ભાટે કરશન
૨ ગંગજી ભાટે સીવગણ
૩ કરશન ભાટે ગંગજી (ભાણજીભા)
૪. નાનજી ભાટે રતનજી

(૧–૪) મુંબઈ [illegible]

૫. દેવજી ભાટે વિશ્રામ
૬. કાનજી ભાટે ગંગાદાસ.
૭. દેવશી ભાટે વાલજી
૮. વિશ્રામભાટે પ્રેમજી
૯. રાણા દેવજી
૧૦. રાણા વિરજી
૧૧. પેથા શિવગણ
૧૨. મુળજી નાથજી
૧૩. પ્રેમજી શીવગણ.
૧૪. ભીમજી દેવજી
૧૫. ગોવિંદ વિશરામ ટાંપુ
૧૬. મુળરાજ કરશન.
૧૭. ગોવિંદ દેવજી.
૧૮. ગોવિંદ કાનજી
૧૯. કરમશી રાઘવ.
૨૦. હીરજી ખીમજી.
૨૧. માધવજી ભીમજી.
૨૨. શીવજી ભીમજી
૨૩ માવજી રાણા.
૨૪. રામજી રાણા.
૨૫. કુરારા વીરજી.
૨૬. રામજી નારણ.
૨૭. કરશન શીવજી.
૨૮. નાનજી રામજી કોટડા.
૨૯. લાલજી માનજી
૩૦ ગોવિંદજી નાથજી.
૩૧. રતનશી ખીમજી નંગાવાળા.
૩૨ શીવજી ગેલા કોટડા.
૩૩ મુળજી વશરામ
૩૪ પ્રેમજી નાનજી વેડો

realpatidar.com

KJ 180

08-Dec-1945

realpatidar.com

॥ ૐ ॥

સં. ૨૦૦૨ના માગશર સુદ ૪ ને શનિવાર ના રોજ ખેડોઈ

ગામે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન ના પ્રતિષ્ઠા પ્રસંગે રાત્રે ૯ વાગ્યાના

[illegible]

[illegible]

પુરુષ પૂજ્ય મહારાજ શ્રી [illegible]

[illegible]

realpatidar.com

[illegible]

realpatidar.com

૨

~~[illegible]~~ ખેડુત ઉતન. જીવન. — ખેડુતના. શાળા. ડગાર ✓

હાથ. કરો સાવર. સાવ ઈશ્વર વર્તાવ્યું. કારણ. પુરુષાર્થ પણ હોવું

જોઈએ. — [illegible] ગુજરાતના. પાટીદાર [illegible]

દાખલા — આગેવાન પ્રધાન. ધર્મ [illegible] — [illegible]

ધર્મ [illegible] — સાત્વિક [illegible] દાખલા. [illegible]

ધર્મ [illegible]. પૂરો જન્મ. ~~[illegible]~~ શક્તિમાં. ~~[illegible]~~ પેદા. [illegible]

[illegible] કરતા. નહી. રહેશે. ને પૂરો જન્મ. આ. શક્તિમાં. આપશે

પેદા. [illegible] સુધારવા. [illegible] ધર્મ [illegible] — ધર્મ છે તેવું.

[illegible] કરી આપે તે. કહે તે. ધર્મ પાળવા. [illegible] છોડ

॥ પરદા [illegible] ~~[illegible]~~

[illegible]

શ્રદ્ધા [illegible] ક્રિયા. કરવા. — [illegible] ધર્મ ન.

[illegible] ધર્મ [illegible] — ~~[illegible]~~ [illegible] કરવા માટે

[illegible] સામે [illegible] [illegible] બાળકો [illegible]

[illegible] [illegible] છે તો. [illegible]

[illegible]

॥ [illegible]

[illegible] ધર્મ [illegible] શું. — [illegible]

[illegible] નહી. [illegible] શું. [illegible] —

[illegible] —

realpatidar.com

॥ [illegible]

[illegible] કાર્યમાં [illegible]

[illegible]

[illegible] છે [illegible]

[illegible] — [illegible] દાખલા. [illegible]

[illegible]

https://archive.org/details/bk1054/page/n16/mode/1up
-Khedoi Laxminarayan Temple Inauguration -Draft Minutes (1054)
realpatidar.com

KJ 181

09-Dec-1945

॥ ૐ ॥

સં. ૨૦૦૨ના માગશર શુદ ૫ ને રવિવાર તા. રાત્રે ૯ વાગ્યા ના શુમારે શ્રી ખેડોઈ ગામે શ્રી કચ્છી કડવા પાટીદાર શનાતન સમાજ ના ૧ જાહેર સભા ભરવામાં આવેલ. તે તે સભામાં થ પ્રસંગ કાર્ય ક્રમ ના નોંધ નીચે મુજબ.

" પ્રથમ સભાના શરૂઆતમાં ઈશ્વર પ્રાર્થના શરૂ [illegible]
શે. [illegible] —

1 આ ગના સભાના પ્રમુખ તરીકે પટેલ ~~[illegible]~~ પરબતભાઈ હાલજી [illegible]
[illegible] — [illegible] - [illegible]

" ટેકો — પટેલ ~~[illegible]~~ ~~[illegible]~~ [illegible] [illegible] કાનજી

" પ્રમુખ ના [illegible] પટેલ [illegible] ~~[illegible]~~ [illegible]
[illegible] —
[illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible] [illegible]
[illegible]

" [illegible] [illegible] [illegible] [illegible]
મહારાજ [illegible] [illegible] [illegible] મહારાજ
[illegible] [illegible] [illegible] વિનંતી.

" મહારાજ [illegible]:-
[illegible] (૧) [illegible] (૨) [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]
[illegible] (૧) [illegible] (૨) [illegible] (૩)
[illegible] [illegible] [illegible].

" [illegible] ~~[illegible]~~ મહારાજ શ્રી [illegible]
[illegible] [illegible] વિનંતી

https://archive.org/details/bk1054/page/n17/mode/1up

realpatidar.com

મહારાજ શ્રી [illegible]નું ભાષણ

ધર્મ એટલે શું? ધર્મમાં ભેદભાવ ન રાખવા જોઈએ.
આગળના ઋષિમુનિઓ અને મહાત્માઓએ ધર્મ માટે ભોગ
આપેલ તે જોઈએ. ધર્મમાં ફેરફારો થયા છે. બાળ લગ્ન અને
વિધવા [illegible] જોઈએ. [illegible] હિન્દુ કોમની [illegible] અને
વિધવા [illegible] ન જોઈએ. વિધવા [illegible]
ધર્મ [illegible] [illegible]. પાટીદારોએ [illegible]
આપવું [illegible]. હિન્દુ અને મુસલમાન ધર્મની [illegible]. પાટીદારો
[illegible] [illegible] ફંડફાળા [illegible] [illegible] સરકાર અને
[illegible] [illegible] [illegible] જોઈએ. ફક્ત [illegible] [illegible]
વિધવા [illegible] છોડાવવા જોઈએ. [illegible] [illegible]
દાખલો. અને [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] ફરેલ [illegible] જોઈએ. ધર્મની રૂઢ અને [illegible]
[illegible] દાખલો. [illegible] ફરેલ મદદ જોઈએ. [illegible]
દાખલો. [illegible] દાખલો. [illegible] મહારાજ [illegible]
[illegible] [illegible]. [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
ફરકાવવા જોઈએ.

મહારાજ શ્રી. [illegible]જી શ્રી. ફરમાન કરેલ તે ઉપરથી.

મહારાજ શ્રી [illegible]નો આભાર. જે કાર્ય [illegible]
લીધેલ છે તે [illegible] જોઈએ. [illegible] દાખલો. [illegible] જોઈએ.
[illegible] દાખલો. [illegible] [illegible] જોઈએ. વિધવા [illegible] અને
[illegible] લાડાની [illegible].

શ્રી ઈશ્વર [illegible] ફરમાન કરેલ તે ઉપરથી.

સૌનો આભાર. તમારી ફરજ. [illegible] [illegible]
સેવા કરવા તૈયાર છું. [illegible] [illegible] [illegible]
[illegible] જોઈએ. [illegible] દાખલો. [illegible] અને [illegible] જોઈએ.
[illegible] અને [illegible] જોઈએ. [illegible] જોઈએ.

શ્રીમાન [illegible]નો આભાર અને ફરમાન કરેલ તે ઉપરથી.

[illegible] ભાઈ ———

~~[illegible]~~ ભાઈ [illegible] ભાઈ

[illegible] [illegible] [illegible] [illegible]. [illegible] આભાર અને
[illegible] ધર્મ [illegible]

https://archive.org/details/bk1054/page/n18/mode/1up

ચાલુ

KJ 182

realpatidar.com

૩ સભા સમિતીના

ચેરમન સોમજીભાઈ લાલજી

વોલન્ટર

૧ પંચાણ ભીમજી
૨ ગોવિંદ લાલજી
૩ ગોવિંદ કેસરા
૪ લાલજી પંચાણ.
૫ કેસરા સોમજી
૬ સામજી લધા
૭ રાજા વિરજી
૮ લાલજી લધા
૯ હરજી માવજી
૧૦ હીરજી સેવગાળ
~~૧૧ [illegible]~~

૪ રસોડા સમીતીના

ચેરમન ગોવિંદભાઈ ગંગાદાસ

૧ ગોવિંદ લાલજી
૨ હીરજીમાવજી

realpatidar.com